



PBM POLYTEX LTD.

REGD. OFFICE: OPP. STATION, POST:PETLAD – 388450,
DIST: ANAND, GUJARAT, CIN : L17110GJ1919PLC000495
PHONE: 224001, 224003, STORES: 224005, SALES: 224006
FAX (02697) 224009, E-Mail:pbmmills@patodiagroup.com

THROUGH BSE.LISTING CENTRE

08.06.2019

To,
The General Manager
M/s. BSE Limited,
Department of Corporate Services,
Floor 25, P. J. Towers, Dalal Street,
Mumbai – 400001

Company Code: BSE Limited, Listing Code – 514087

Sir / Madam,


REF: DISCLOSURE UNDER REGULATION 30 OF THE SEBI (LISTING OBLIGATIONS AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2015
SUB: SUBMISSION OF COPIES OF NEWSPAPER NOTICES IN RESPECT OF TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO THE INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF) ACCOUNT.

With reference to the above cited subject, we attach herewith copies of Notices published on 08.06.2019 in the newspapers named "The Financial Express – English Edition" and "Naya Padkar – Gujarati Edition" for attention of the Equity Shareholders of the Company regarding transfer of equity shares of the Company, on which dividend remains unpaid / unclaimed for a period of consecutive seven or more years, to the Investor Education and Protection Fund (IEPF) Account as per the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended from time to time.

The details of such Equity Shareholders are also available on Company's website www.pbmpolytex.com

Please acknowledge the receipt.

Thanking you,
Yours faithfully,
For PBM Polytex Limited


(Gopal Patodia)
Managing Director
(DIN : 00014247)

ENCL: Copies of Newspapers Advertisement.

Govt may remove landing fee at 15 defence airports

PRESS TRUST OF INDIA
New Delhi, June 7

IN ORDER to boost regional connectivity, the Centre may remove the landing charges for aircraft having less than 80 seats at 15 defence airports, government officials said on Friday.


"Landing charges are paid by an airline to the airport as per the weight of the aircraft during each landing. Defence airports come under the control of the Indian Air Force.

"An airline has requested the civil aviation ministry to waive the landing charges on 15 defence airports for aircraft

that have less than 80 seats. It has been decided that the civil aviation secretary would formally take up this matter with the Ministry of Defence soon," a senior government official said.

Another senior government official said, "The aircraft, which have less than 80 seats, are helping in ensuring regional connectivity from the cities where these 15 defence airports are located. Therefore, the (civil aviation) ministry thinks that landing charges should be waived by the defence ministry."

The Ministry of Defence



has informally stated that this proposal of waiving landing charges is feasible. However, no formal communication has taken place between the Min-

istry of Civil Aviation and the Ministry of Defence as yet, the official added.

Currently, in India, the older Q400, aircraft used by

SpiceJet and the ATR aircraft used by IndiGo have less than 80 seats. As number of air passengers are low in small cities, such aircraft are used there.

Defence airports across the country are controlled by the Indian Air Force as it uses them as an air base. When a part of such defence airports are classified as "civil enclave" and handed over to the Airports Authority of India (AAI), it is used to start commercial flight operations.

The aforementioned 15 airports conduct their commercial flight operations from such civil enclaves only.

CERC calculates FY19 average power price at ₹3.60 per unit

FE BUREAU
New Delhi, June 7

THE AVERAGE PRICE at which states procured non-renewable electricity (mostly coal-based) in FY19 was ₹3.60/unit, according to the latest calculations done by the Central Electricity Regulatory Commission (CERC).

The figure is about 2% higher than the average price in FY18. The price does not include transmission charges. The total cost of non-renewable power in FY19 across the

country was ₹3.9 lakh crore, 5.6% higher than that of the previous fiscal. The volume of such electricity consumed was 1,093 billion units, up 3.3%.

The national-level cost was derived by computing average prices paid by all states/UTs, weighted by volume of conventional power purchased by them. The major states which paid the highest power prices are Bihar (₹4.12/unit), Jharkhand (₹3.99/unit), Gujarat (₹3.98/unit), Telangana (₹3.92/unit) and Delhi

(₹3.90/unit). Electricity tariffs from thermal generating stations are determined either by the cost-plus system (based on actual expenses and expected returns), or through competitive bidding. The average price of non-renewable electricity helps to calculate the compensation for wind or solar plants which sell power under the 'renewable energy certificates' framework, and for captive plants without power purchase agreements.

ED files money laundering case against journalist


PRESS TRUST OF INDIA
New Delhi, June 7

THE ENFORCEMENT DIRECTORATE (ED) has filed a money laundering case against media baron Raghav Bahl for alleged laundering of funds to purchase an undisclosed foreign asset, officials said on Friday.

Bahl denied any wrongdoing and said he has timely furnished all records to tax authorities.

They said an enforcement case information report (ECIR), a police FIR equivalent, was lodged by the federal agency early this week after taking cognisance of an income tax department complaint against him and others.

The case had been filed under the Prevention of Money Laundering Act (PMLA). The ECIR was filed after going into the merits of the I-T depart-



Raghav Bahl

ment charge sheet and the evidences recorded in it, they said.

The I-T department had recently filed a charge sheet against Bahl before a court in Meerut under the provisions of the anti-black money law or the Black Money (Undisclosed Foreign Income and Assets) and Imposition of Tax Act of 2015.

Bahl acknowledged the En-

forcement Directorate action, saying the agency has acted after taking cognisance of the tax department charge sheet filed for alleged non-disclosure of Rs 2.38 crore paid towards the purchase of a property in London.

He alleged that he was "getting the sense of being hounded for doing no wrong despite paying all taxes honestly and diligently." "I also have no defaults when it comes to the debt obligations of myself or my business concerns," he said in a letter emailed to finance minister Nirmala Sitharaman and the chiefs of the CBDT and the ED.

The letter has been shared with PTI by his organisation.

Bahl, in the letter, said he and his wife had made "full disclosures" in their tax returns which address the legal issues in the notices issued by

the I-T department, which claimed the London property was an undisclosed asset created by pumping in black money.

"I have already challenged the show cause notices and subsequent acts in a writ petition before the Allahabad High Court," he said in the letter.

Bahl said he was writing to the FM "to intervene not just on my behalf but to see to it that a necessary and laudable drive to track and punish money launderers and black money hoarders is not allowed to degenerate into diversion of resources to hound innocents".

"Indeed, such action takes away from the authorities' ability to pursue real perpetrators, which would serve to defeat the very objectives of these legislative measures, besides wasting precious judicial time and resources," Bahl wrote.

MS Dhoni will have to remove dagger insignia from gloves: ICC

PRESS TRUST OF INDIA
London/Mumbai, June 7

TAKING A FIRM stand, the ICC on Friday denied Mahendra Singh Dhoni permission to wear the dagger insignia on his wicket-keeping gloves during the World Cup despite BCCI's assertion that it was not a military symbol.

The Indian cricket board (BCCI) had sought permission for the star batsman from the world governing body, which eventually cited regulations in denying the permission.

"The ICC has responded to the BCCI to confirm the logo displayed by MS Dhoni in the previous match is not permitted to be worn on his wicket-keeping gloves at the ICC Men's Cricket World Cup 2019," an ICC statement said.

"The regulations for ICC events do not permit any individual message or logo to be displayed on any items of clothing or equipment. In addition to this, the logo also breaches the regulations in relation to what is permitted on wicketkeeper gloves."


During India's opening World Cup game against South Africa in Southampton, Dhoni's green keeping gloves had a dagger logo embossed, which looked more like an Army insignia.

The rule-book allows for only one sponsor's logo on the wicket-keeping gloves. In Dhoni's case, he already sports an SG logo on his gloves.

Dhoni is an Honorary Lieutenant Colonel in the Parachute Regiment of the Territorial Army and dagger is part of their emblem.

Committee of Administrator (CoA) chief Vinod Rai had argued that wearing the dagger insignia does not breach any rule.

"As per ICC regulations, players can't sport any commercial, religious or military logo. Otherwise, it would not interfere in this regard as we all know. And it is not the paramili-



Furore in India

The International Cricket Council (ICC) has asked India's Mahendra Singh Dhoni to remove an army insignia from his wicket-keeping gloves, forcing New Delhi to weigh in after a nationalistic furore in the country.

Dhoni, one of the game's biggest stars, is an honorary lieutenant colonel in the territorial army and sported its dagger insignia on his gloves during India's opening match against South Africa in the World Cup, hosted by England and Wales.

"The government does not interfere in matters of sports bodies, they are autonomous," sports minister Kiren Rijiju said on Twitter. —REUTERS

tary regimental dagger that is embossed in his gloves. So Dhoni is not in breach of ICC regulations," Rai said.

Rai's comment came after the ICC "requested the BCCI" to ask Dhoni to remove the logo from the gloves, citing rules which forbid display of messages "which relate to political, religious or racial activities or causes."

The CoA's defence was based on the fact that the para-regimental dagger logo has word 'Balidan' (sacrifice) inscribed on it, which is not the case with the logo sported by Dhoni.

Dhoni also got support from Sports Minister Kiren Rijiju, who had urged the BCCI to resolve the matter.

"...the issue is connected with the sentiments of the country, the interest of the nation has to be kept in mind. I urge the BCCI to take a fair step in the Mahendra Singh Dhoni? case," Rijiju wrote on his twitter handle.

Various sportspersons such as Suresh Raina and decorated wrestler Yogeshwar Dutt also backed the former captain.

Qureshi writes to Jaishankar; offers talks on 'all important matters'

PRESS TRUST OF INDIA
Islamabad, June 7

PAKISTAN FOREIGN MINISTER Shah Mehmood Qureshi in a congratulatory letter to his new Indian counterpart S Jaishankar has said that Islamabad wants talks with New Delhi on "all important matters" and remains committed to efforts for establishing peace in the region, according to a media report on Friday.

Qureshi wrote the letter to Jaishankar to congratulate him for taking over as the external affairs minister.

Former foreign secretary Jaishankar assumed charge as the external affairs minister on May 30.

Qureshi "Islamabad wants talks with New Delhi on all important matters and remains committed to efforts for establishing peace in the region," the Express Tribune reported quoting diplomatic sources.

Tensions between the two countries worsened after the Pulwama terror attack and both the countries were almost on the brink of a war after India's military planes struck a terrorist training camp in Pakistan's Balakot on February 26 and Pakistan carried out a counter-offensive the next day.

Breaking the ice in bilateral ties, Pakistan Prime Minister Imran Khan on May 26 spoke to Prime Minister Narendra Modi on phone and expressed his desire to work together for peace and prosperity in the region.

Modi on his part offered for creating trust and an environment free of violence and terrorism for fostering peace and prosperity in the region.

India has rejected Pakistan's offer of talks, maintaining that terror and talks cannot go together.

Wonderla Holidays needs ₹260 cr more to complete its Chennai project

SAJAN C KUMAR
Chennai, June 7

WONDERLA HOLIDAYS, WHICH runs amusement parks, has said the company needs an additional ₹260 crore for the completion of its proposed park in Chennai. The publicly-listed company has already invested about ₹104 crore on the Chennai park project which included the land acquisition and the connected costs.

Joint managing director George Joseph told an earning conference recently that it had ₹130 crore in its books while the cash generation during the construction period will be ₹100-₹120 crore. "So, we may have to go for a small external borrowing for the completion or supplier credit. Then, we may utilise reserves for buying the land for the next location," he said.

Explaining the delay for starting work on the Chennai park, he said Chennai had been a peculiar case because land acquisition itself took about four to five years. Chennai park is expected to be completed within 15 to 18 months after construction begins. "Everything is ready, but we are still waiting for the notification exempting the amusement park from the local body tax. Hopefully, we will then submit the papers for approvals, which will take only one month because there is a single-window system," he said.

According to him, by that time, land will be ready in fifth location. He believes whatever happened in Chennai will not happen in the next location. Wonderla Holidays currently has amusement parks in Kochi, Bengaluru and Hyderabad.

The company has chalked out a capital expenditure plan of ₹28 crore for its existing parks. It will be adding new rides in Bengaluru and Kochi while some are in process at



Hyderabad.

"For advertising and marketing, we have a budget of about ₹20 crore. We are looking to change the ad mix. Earlier, we were spending a lot on print media. We observed that it was not getting fair result because our target group is

more into digital than print media. Hence, we are going to increase online penetration and advertising via hoardings and movie theatres," he said.

Speaking about the way the digital initiatives of the company are paying off, he said the footfall growth on the

account of online bookings was growing. "There was a growth of about 30% last year and we had online booking by over 2 lakh visitors and the beginning of current year has been good. The peak season is seeing more of direct walk-in, so, the contribution of online partners is going up and we are really happy about it," he said.

On the plans for vacant land in the existing parks, Joseph said when the company goes for a project, it always keeps some land for expansion purpose. "If it requires 20 to 25 acres, we buy at least 25 to 30 acres of additional land for the purpose of future expansion of the park. In Bengaluru, we established a resort attached to the park and it has been paying off. This may be replicated in other parks," he said.

PBM POLYTEX LTD.
CIN : L17110GJ1919PLC000495
Regd. Office: Opp. Station, Post: Petlad - 388450, Dist: Anand, Gujarat
Phone: (02697) 224001, Fax: (02697) 224009,
Website: www.pbmpolytex.com | Email ID: pbmmills@patodiagroup.com

Notice to Shareholders for the Transfer of unpaid/unclaimed dividend and Equity Shares of the Company to the Investor Education and Protection Fund (IEPF) Account.

This Notice is published pursuant to the provisions of section 124 of the Companies Act, 2013 ("the Act") read with Investor Education and Protection Fund ("IEPF") Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 ("the said Rules"), as amended/modified/re-transferred from time to time.

The said Rules, amongst other matters, contain provisions for transfer of unpaid or unclaimed dividend and Shares, in respect of which dividend remains unpaid or unclaimed for consecutive seven or more years to the IEPF Account.

The unclaimed/unpaid dividend for seven consecutive years from the Financial Year 2011-12 is presently lying with the Company in respect of many shareholders. In accordance with the IEPF Rules, the concerned shareholders are given an opportunity to claim such dividend by sending a letter through Registered Courier under their signature so as to reach the Company's Registrar and Share Transfer Agent (RTA), M/s. Link Intime India Pvt. Ltd., B-102 & 103, Shangrila Complex, Opp. HDFC Bank, Near Radhakrishna Char Rasta, Akota, Vadodara - 390020 latest by 30th September 2019. The details of Equity shares held by the Equity Shareholders which, if not claimed, will be transferred to IEPF Account, are available on the Company's website www.pbmpolytex.com under the Clause "Investor Relations". In case, valid claim is not received by the RTA by the aforementioned date, the Company will have no option but to take action towards the transfer of the shares to IEPF, pursuant to the IEPF Rules. The concerned shareholder(s), holding share(s) in physical form and whose shares are liable to be transferred to the IEPF Account, may note that the Company would be issuing New Share Certificates in lieu of Original Share Certificates held by the shareholder for the purpose of transfer to the IEPF Account in favour of the IEPF Authority as per the amended Rules and upon issue of such New Share Certificate(s), the original Share Certificate(s) which stand registered in your name will be deemed cancelled and non-effective. It may also be noted that the dividend accruing on such transferred shares will also be paid to IEPF till the shares stand in the IEPF Account.

Upon transfer of shares to IEPF, Shareholders can claim the shares from the IEPF. For claiming such shares, the shareholders are required to follow the procedure as under:

- Make an online application in Form IEPF-5 available on the website www.iepf.gov.in along with the fee as may be prescribed by the Central Government, from time to time;
- Send a copy of the online application duly signed by him/her along with all documents mentioned in Form IEPF-5 to the Company's RTA for verification of his/her claim;
- Individual Notice dated 6th June, 2019 in this regard has been sent to the concerned members by Registered post at the address registered with the Company. In case the members have any queries on the subject matter, they may write to us or our Registrar and Share Transfer Agent (RTA) at the address mentioned above or send e-mail at alpesh.gandhi@linkintime.co.in or pbmmills@patodiagroup.com or by calling at Telephone No. 0265-2356573.

By order of the Board
For PBM Polytex Limited
Sd/- (Gopal Patodia)
Managing Director (DIN : 00014247)

Place : Petlad
Date : 07.06.2019

गार्डेन रीच शिपबिल्डर्स एण्ड इंजीनियर्स लिमिटेड
Garden Reach Shipbuilders & Engineers Limited
(A Govt. of India Undertaking, Ministry of Defence)
Regd. Office : 43/46, Garden Reach Road, Kolkata-700 024
Tel: (033) 2469-8545; Fax: (033) 2469-8159
Website: www.grse.in, E-mail: co.sec@grse.co.in
(CIN: L35111WB1934G0007891)

NOTICE

Notice is hereby given that pursuant to Section 110 of the Companies Act, 2013 (the "Act") read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Garden Reach Shipbuilders & Engineers Limited (the "Company") seeks approval of the Shareholders for the resolutions as set out in the Postal Ballot Notice dated 29th May, 2019.

The Company has completed dispatch of Postal Ballot Notice alongwith Postal Ballot Form on Friday, 7th June, 2019, in electronic mode to the Shareholders whose e-mail IDs are registered in the records of depository participants as on the cut-off date i.e. Friday, 31st May, 2019 and in physical mode along with a pre-paid postage self-addressed Business Reply Envelope to those Shareholders, as on cut-off date, whose e-mail ID's were not registered. The voting rights will be reckoned on the equity shares registered in the name of the Shareholders as on the cut-off date. Any person who is not a Shareholder as on the cut-off date shall be treated as a Shareholder for information purposes only.

The Board of Directors of the Company (the "Board") at its Meeting held on 29th May, 2019 has appointed, Mr. A. K. Labh, Practising Company Secretary of M/s. A. K. Labh & Co., Company Secretaries, as the Scrutinizer for conducting the postal ballot process in a fair and transparent manner.

In compliance with the provisions of Sections 108 and 110 of the Act read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended, the Company is pleased to provide e-voting facility to its Shareholders enabling them to cast their votes electronically for the resolutions as set out in the Postal Ballot Notice dated 29th May, 2019 through the e-voting services provided by National Securities Depository Limited ("NSDL").

Shareholders may please note that voting, both physical and in electronic mode, shall commence on Sunday, 9th June, 2019 (9.00 a.m.) and ends on Monday, 8th July, 2019 (5.00 p.m.). Duly completed Postal Ballot Form should reach the Scrutinizer not later than the close of working hours i.e. 5.00 p.m. on Monday, 8th July, 2019 at the address mentioned in the Business Reply Envelope. The e-voting module shall be disabled by NSDL for e-voting thereafter. Postal Ballot Forms received after close of voting mode will be considered invalid.

A Shareholder may opt for only one mode of voting i.e. either through Postal Ballot Form or remote e-voting. If a Shareholder casts vote by both the modes, then the votes cast through remote e-voting shall prevail.

Any Shareholder who did not receive Postal Ballot Form or wish to obtain a printed Postal Ballot Form or a duplicate Form, may either send e-mail to the Company Secretary at co.sec@grse.co.in or to the Company's Registrar and Share Transfer Agent at rtal@alankit.com, who shall forward the same along with Business Reply Envelope to the Shareholder.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-9900 or send a request at evoting@nsdl.co.in.

The result of the Postal Ballot (including e-voting) shall be declared on or before Wednesday, 10th July, 2019. The said results would be displayed at the Registered Office of the Company by placing the same along with the Scrutinizer's Report on the Company's website at www.grse.in. The voting results will be intimated to the stock exchanges where the shares of the Company are listed, depositories, registrar and share transfer agent and shall also be displayed on the website of NSDL i.e. www.evoting.nsdl.com

For Garden Reach Shipbuilders & Engineers Limited
Sd/-
Sandeep Mahapatra
Company Secretary and Compliance Officer

Place: Kolkata
Date: 7th June, 2019

"In pursuit of Excellence and Quality in Shipbuilding"
Visit us at : www.grse.in

Muthoot Homefin (India) Ltd
Corporate Office : 1201 & 1202, 12 th Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063.

POSSESSION NOTICE
(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of the Muthoot Homefin (India) Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice calling upon the borrower Mr. Vijaybhai Aravindbhai Gabu And Mr. Kamlesh Aravindbhai Gabu And Mrs. Manchabhai Arvindbhai Gabu to repay the amount mentioned in the notice dated 9th July 2019, being Rs. 07,45,856/- (Rupees Seven Lakh Forty Five Thousand Eight Hundred Fifty Six Only) up to 31/01/2019 along with interest @ 12.5% plus penal interest @ 24% per annum, charges, costs etc. within 60 days from the date of the said notice.

The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower, in particular and the public, in general, that the undersigned has taken physical possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 9 of the said Rules on 05 Day of June, 2019.

The borrower, in particular, and the public, in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Muthoot Homefin (India) limited, for an amount of Rs. 07,45,856/- (Rupees Seven Lakh Forty Five Thousand Eight Hundred Fifty Six Only) along with interest thereon and penal interest @ 24%, charges, costs etc. from 31/01/2019.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
36.19 sq.mts comprising in Northren Part from land admeasuring 73.90 sq.mts of Southern side of Plot No.44 paiki a forming part of Non agricultural land of revenue survey No.416/3 paiki 1 of village botad of Taluka & District Botad presently known as " KESHAV PARK ", Gujarat - 364710 More Particularly in the sale. Deed Registered as Document with Sr.No.3525/2017 Dated 05/09/2017 in the office of Sub Registrar Botad.

Boundary by North : Remaining Land of this Plot No.123, South : Common Plot, East: Non Agriculture land of 425/1 paiki and West : 6.00 mts wide road.

Sd/-
Authorized Officer
For Muthoot Homefin (India) Ltd.

Date : 08-06-2019
Place : Botad

COSMOS BANK
THE COSMOS CO-OP. BANK LTD.
(Multistate Scheduled Bank)

Mumbai Regional Office: Horizon Building, 1st Floor, Ranade Road & Gokhale Road Junction, Gokhale Road (North), Dadar (West), Mumbai 400 028.
Phone No. 022-24476008/54/57

E-Auction SALE NOTICE UNDER SARFAESI ACT, 2002
E-auction Sale Notice for Auction of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Enforcement) Rules, 2002 read with provision to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower Company through its Directors and Guarantors that the below described immovable property mortgaged to the secured creditor, the physical possession of which has been taken by the Authorized Officer of The Cosmos Co.Op. Bank Ltd., will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" on 27.06.2019 through E-Auction between 12:00 Noon to 1:00 P.M. with unlimited extension of 5 min each, for recovery of Rs. 37,20,41,146.14 as per demand notice dated 05.10.2018 and present outstanding as on 31.05.2019 is Rs. 34,02,54,389.14 + Further Interest thereon in Accounts & is due to the The Cosmos Co.Op. Bank Ltd from M/s. Dilip Chhabria Design Pvt. Ltd.... (Borrower company) and Directors & Guarantors- 1) Mr. Dilip Harkishin Chhabria, 2) Ms. Kanchan Harkishin Chhabria, 3) Mr. Bonito Dilip Chhabria, 4) Mr. Kirankumar Moolchand Jain, 5) Mrs. Pervy Dilip Chhabria, 6) M/s. Bhavya Homes Pvt. Ltd. through its Director Mr. Kirankumar Moolchand Jain, 7) M/s. Lalitha Castle Pvt Ltd through its Director Mr. Kirankumar Moolchand Jain. The reserve price of Immovable Property will be Rs. 3,85,00,000/- (Rupees Three Crores Eighty Five Lakhs Only) and the earnest money deposit is Rs. 38,50,000/- (Rupees Thirty Eight Lakhs Fifty Thousand Only).

Description of Immovable Property
Owned by- Ms. Kanchan Harkishin Chhabria
All that piece and parcel of the land and ground situated within the limits of Zilla Parishad Pune and G.P. Mouje Bhugaon, "Golden Horizon Project" bearing Plot No. B-34 out of the sanction layout of P.No. 183 (P), 185 (P) of village Bhugaon adm. 4119 sq.mtrs. with right of ways easement available to said plot of land and the said plot of land is bounded as follows:
On or towards East : By Colony Road
On or towards West : By Colony Road
On or towards North : By Plot No. 33
On or towards South : By Colony Road and then Plot no. 35.

Note :-
1. For inspection of Subject property will be open on 21.06.2019 between 11:00 A.M. To 4:00 P.M.
2. EMD forms are available with Authorized Officer.
3. Please contact for EMD payment details to Authorized Officer.
For detailed terms and conditions of the public auction sale, please refer to the link provided in Secured Creditor's website i.e. https://www.cosmosbank.com OR https://cosmosbank.auctiontiger.net

Place : Mumbai
Date : 08.06.2019

Sd/-
Authorized Officer
The Cosmos Co-operative Bank Ltd.



